

BOMBAY SUPER HYBRID SEEDS LIMITED

Plot No. 8,9,10,11, Shreenathji Industrial Estate, Near Kuvadva GIDC, N.H. 27, Kuvadva-360 023.
Dist. Rajkot. (Gujarat) INDIA · CIN No. L01132GJ2014PLC080273

Ref. BSHSL\NSE\NewspaperPublication

February 08, 2022

To,
National Stock Exchange of India Ltd.
Exchange Plaza,
Plot no. C/1, G Block,
Bandra-Kurla Complex,
Bandra (E) Mumbai - 400 051
Ph : (022)-26598100-8114
Fax No: (022)-26598120

SUB: Submission of NEWSPAPER Publication of Financial Statement for the quarter ended on December 31, 2021.

Script Symbol: BSHSL


Dear Sir,

We would like to inform the Exchange that, with reference to regulation 47 of SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015, Kindly find enclosed Newspaper Advertisement regarding the Board Meeting held on Monday, February 07, 2022 wherein the unaudited Financial Statement for Quarter and Nine Months ended on December 31, 2021 were approved and same has been published in Business Standard (English Edition) and Sanj Samachar (Gujarati Edition) on February 08, 2022.

Kindly take the same in your record.

Thanking you

For, Bombay Super Hybrid Seeds Limited



CS Jalpa Doshi
Company Secretary & Compliance Officer



+91 96879 66796 · +91 98984 00458

info@bombaysuper.in

www.bombaysuperseeds.com

YES BANK

A/C No. : 009881300001880 · IFSC Code : YESB0000098 · Branch : Race Course Road, Rajkot

Union Bank of India **યુનિયન બેંક ઓફ ઇન્ડિયા**
 Regional office Mehmeta, Nr. Wide angle, Mehmeta Ph 02762-230246, 240250.
CORRIGENDUM
 General Public is informed that undersigned had Published E - Auction Sale Notice, M/s. Pramukh Oil Ind., in Business Standard on 07.02.2022, in which please read E-Auction Date: 24.02.2022 instead of '20.02.2022'. All other terms and conditions will remain unchanged, which please note.
 Sd/-
 Date : 08-02-2022 Authorized Officer

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા **UCO BANK**
Vapi Branch, Vaishali Cinema Complex, Koparli Road, Vapi, Valsad, Gujarat - 396191
POSSESSION NOTICE (Under Rule 8(1) Security Interest (Enforcement) Rules, 2002)
 The undersigned being the authorized officer of the UCO Bank, Vapi Branch, Vaishali Cinema Complex, Koparli Road, Vapi, Valsad, Gujarat - 396191 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 23/06/2021 calling upon the Borrower M/s Gujarat Enterprise Proprietor Md Wasim Navi Khan & Guarantor Md Navi Rafik Khan to repay the amount mentioned in the notice being Rs. 8,03,597.58 (Rupees Eight Lakh Three Thousand Five Hundred Ninety Seven Paise Fifty Eight only) Inclusive of interest up to 16/01/2021.
 The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower/ Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 5th day of February of the year 2022.
 The Borrower/ Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the UCO Bank, Vapi Branch, Vaishali Cinema Complex, Koparli Road, Vapi, Valsad, Gujarat - 396191 for an amount Rs. 8,03,597.58 (Rupees Eight Lakh Three Thousand Five Hundred Ninety Seven Paise Fifty Eight only) Inclusive of interest up to 16/01/2021.
 The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
Description of the Immovable Property
 Particulars of the immovable properties mortgaged to the bank As per Original Sale Deed No.1053/1999 dated 28.05.1999 - Revenue Survey No. 562/A/1 paiki City Survey No 3069 Vapi 396191 Gujarat
 All that piece and parcel of the constructed Super Built up Area admeasuring about 1400 sq.ft. equivalent to 130.11 sq.mtrs for the said Flat No. 1/1 J/34 of Five Floor in Building Known as Jay Tower - 1 with all other appurtenances rights and easement there to. In the property constructed in All that piece and parcel of Non-Agricultural Land bearing one consolidated Revenue Survey No.562/ A/ 1 paikae, totally admeasuring about H-0-79 Are-75 p.a. are equivalent to 7975 Sq.mtrs. Situated within the municipal limit of Vapi, Taluka Pardi, Dist Valsad, Gujarat with all other easement rights and appurtenances there to and surrounded as follows.
 Bounded As : East: By adjoining property of City Survey No.3070, West: By adjoining property of City Survey No 3055, 1974, 1973, 1972, North: By adjoining property of City Survey No 1937 & 1970, South: The main Public Road known as Silvasa Road
 Date : 05/02/2022 | Place : Vapi Authorized Officer, UCO Bank

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા **Bank of Baroda**
College Road Branch :
College Road, Opp. Bahaudin College, Junagadh - 362001
POSSESSION NOTICE - Symbolic (For immovable property)
 Whereas, The undersigned being the Authorised Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 11-10-2021 calling upon the Borrower Mr. Rameshbhai Gordhanbhai Dobariya to repay the amount mentioned in the notice being Rs. 4,25,664.26 (Rupees Four Lakh Twenty Five Thousand Six Hundred Sixty Four and Twenty Six Paise Only) within 60 days from the date of receipt of the said notice.
 The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub section (4) of section 13 of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 07th day of February of the year 2022.
 The Borrower/ Guarantor/ Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs. 4,25,664.26 (Rupees Four Lakh Twenty Five Thousand Six Hundred Sixty Four and Twenty Six Paise Only) and interest thereon at the contractual rate plus cost, charges and expenses till date of payment.
 The borrower's attention is invited to provision of sub-section (8) section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
Description of the Immovable property
 All that Part and Parcel of the Property consisting of Flat No. 108, Admeasuring Sq. Mtrs. 41.83 on the First Floor of "Shreenathji Palace", Multi stories building construction on Total Land Sq. Mtrs. 1059.49 of Plot No. 31 to 35 of N. A. R. Survey No. 47/1/P1 Hc, Aare Sq. Mtrs. 1-19-39, which is known as Siddhi Vinayak - 1 situated at Khalipur Road, Josphara, Junagadh, Gujarat - 362 001 belonging to Mr. Rameshbhai Gordhanbhai Dobariya.
 Bounded :
 On the East : Flat No. 109 with Common Wall
 On the West : OTS and Flat No. 107 with Common Wall
 On the North : Common Passage and Main door of the Flat
 On the South : Margin Place and another Property
 Date : 07.02.2022 Chief Manager & Authorised Officer
 Place : Junagadh Bank Of Baroda

APPENDIX IV
 (See rule 8 (1))
POSSESSION NOTICE
 (for immovable property)
 Whereas,
 The undersigned being the Authorized Officer of **INDIABULLS HOUSING FINANCE LIMITED (CIN:L65922DL2005PLC136029)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 23.09.2021 calling upon the Borrower(s) **JANARDAN KUMAR NAWAL SINGH SHARMA, JANARDAN KUMAR NAWAL SINGH SHARMA ; OFFICE NO. 5119, 5TH FLOOR, 'D' WING, OBEROI GARDEN ESTATE, CHANDIVALI, ANDHERI (EAST), MUMBAI, MAHARASHTRA - 400072, RINKU KUMARI; 101, SAIKIRAN APPARTMENT, HANUMAN FALIYA, NR. HIRA FACTORY MOGRAWADI, VALSAD, GUJARAT - 396001, SHRIKANT RAMKRISHNA SHARMA: D-06/324, BUILDING NO. 14, RAJ ABHISHEK CITY HOMES, MOJE PARDI-KARDE, SACHIN PALSANA ROAD, SACHIN, SURAT, GUJARAT - 394110** to repay the amount mentioned in the Notice being Rs. 8,95,081.71 (Rupees Eight Lakh(s) Ninety Five Thousand Eighty One And Paise Seventy One Only) against Loan Account No. HHL5UR00130372 as on 21.09.2021 and interest thereon within 60 days from the date of receipt of the said Notice.
 The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 03.02.2022
 The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **INDIABULLS HOUSING FINANCE LIMITED** for an amount of Rs.8,95,081.71 (Rupees Eight Lakh(s) Ninety Five Thousand Eighty One And Paise Seventy One Only) as on 21.09.2021 and interest thereon.
 The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.
DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
FLAT NO. - 385, RAJ ABHISHEK CITY HOME, BUILDING NO. : D-21, SACHIN - PALSANAROAD, SURAT, GUJARAT - 394210.
 Sd/-
 Date : 03.02.2022 Authorized Officer
 Place: SURAT INDIABULLS HOUSING FINANCE LIMITED

બેંક ઓફ બરોડા **Bank of Baroda**
Patel Colony Branch :
 Shivam Plaza-II, Opp. D.K.V. College, Jamnagar - 361 008
POSSESSION NOTICE (For Immovable property)
 Whereas, The undersigned being the Authorised Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 30/11/2021, calling upon the Borrower Mr. Balakrishna Binu Sio-Madhavan Balakrishna & Mrs. Deena Binu, W/o - Balakrishna Binu to repay the amount mentioned in the notice being Rs. 31,77,458.73 + further interest and incidental charges And other charges etc thereon w.e.f 23/11/2021 (Rupees Thirty One Lakhs Seventy Seven Thousand Four Hundred Fifty Eight & Seventy Three paise only) as on 30.11.2021 together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment within 60 days from the date of receipt of the said notice.
 The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 07th day of February of the year 2022.
 The Borrower/ Guarantors/ Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs. 31,77,458.73 + further interest and incidental charges And other charges etc thereon w.e.f 23/11/2021 (Rupees Thirty One Lakhs Seventy Seven Thousand Four Hundred Fifty Eight & Seventy Three paise only) and further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment.
 The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
Description of the Immovable Property
EM of Flat Situated at Flat No. A/203, Manek Ratna Apartment, Seru section Road, Near Seva Sadan, Jamnagar, Gujarat
 Bounded as by :
 On the East By : OTS then after others property On the North By : Flat No. A/202
 On the West By : Public Road On the South By : Open space and Flat No. B/201
 Place : Jamnagar Sd/-, Chief Manager & Authorised Officer,
 Date : 07.02.2022 Bank Of Baroda

બેંક ઓફ બરોડા **Bank of Baroda**
SOLA ROAD BRANCH, A.P.M SHOPPING MALL, OPP SUN-N-STEP CLUB, SOLA ROAD, AHMEDABAD-380001, GUJARAT
 PHON: 91 079 27495100, (D) 27495200, EMAIL: Lsolahm@bankofbaroda.com
POSSESSION NOTICE
APPENDIX-IV (FOR IMMOVABLE PROPERTY) [SEE RULE 8(1)]
 Whereas,
 The undersigned being the Authorised Officer of Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 14-10-2021 calling upon the Borrower **Shri Tushar Shantilal Kothari And Guarantor Shri Vinod Kumar K Patel** to repay the amount mentioned in the notices aggregating **Rs.1,91,85,388/- (Rupees One Crore Ninety One Lakhs Eighty Five Thousand Three Hundred and Eighty Eight Rupees Only)** with further interest thereon as mentioned in the notice, till the date of payment and incidental expenses, costs, charges incurred / to be incurred less recovery.
 The Borrower / Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantor and the public in general that the undersigned is in symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this 2nd day of February of the year 2022.
 The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs.1,91,85,388/- (Rupees One Crore Ninety One Lakhs Eighty Five Thousand Three Hundred and Eighty Eight Rupees Only) with further interest thereon as mentioned in the notice, till the date of payment and incidental expenses, costs, charges incurred / to be incurred less recovery.
 The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.
DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
 All that piece and parcel of property owned by **Shri Tushar Shantilal Kothari** being Plot No 1 admeasuring 252.51 Sq. Mtrs i.e. 302 Sq. Yards [As per Revenue Records 382 Sq. Mtrs] together with construction standing thereon and Plot No 13 admeasuring 328.26 Sq. Mtrs i.e. 392.56 Sq. Yards in the scheme known as "Parvatnagar" both situated on land bearing Final Plot No 119/P T.P. Scheme No 3 (Survey No 751) District Ahmedabad and being at Village Vajapur, Taluka City, Registration District Ahmedabad and Sub District Ahmedabad-4 [Paldi] and bounded as:
 By East : Property forming part of F P No 119/P. By West : Road
 By North : Sub Plot No 2 and 12 of F P No 119/P. By South : T P Road
 Date : 02/02/ 2022 Authorized Officer
 Place : Ahmedabad BANK OF BARODA

HERO HOUSING FINANCE LIMITED
 Regd. Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057, Ph: 011 49267000, Toll Free No: 1800 212 8800, Email: customer.care@herohf.com
 Website: www.herohousingfinance.com | CIN: U65192DL2016PLC30148
DEMAND NOTICE
 Under Section 13(12) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("Act") read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 ("Rules").
 Whereas the undersigned being the Authorised Officer of Hero Housing Finance Limited (HHFL) under the Act and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Rules already issued detailed Demand Notices dated below under Section 13(2) of the Act, calling upon the Borrower(s)/Co-Borrower(s)/Guarantor(s) (all singularity or together referred to as "Obligors") Legal Heir(s)/Legal Representative(s) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notice(s), within 60 days from the date of the respective Notice(s), as per details given below. Copies of the said Notices are served by Registered Post A.D. and are available with the undersigned, and the said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s), may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours.
 In connection with the above, Notice is hereby given, once again, to the said Obligor(s) / Legal Heir(s)/Legal Representative(s) to pay to HHFL, within 60 days from the date of the respective Notice(s), the amounts indicated herein below against their respective names, together with further interest as detailed below from the respective date as mentioned below in column (d) till the date of payment and / or realization, read with the loan agreement and other documents/writings, if any, executed by the said Obligor(s). As security for due repayment of the loan, the following Secured Asset(s) have been mortgaged to HHFL by the said Obligor(s) respectively.

Loan Account No.	Name of Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s)	Total outstanding Due Rs. as on	Date of Demand Notice	Date of NPA
HHSURHOU/19000003686 & HHSURIRPL/19000004396	Mr. Dhandhukhiya Govind Chimanbhai & Mr. Pravin Chimanbhai Dhandhukhiya & Mrs. Dhandhukhiya Daxaben	Rs. 14,82,503/- as on 24-Jan-2022	24-Jan-2022	07-JAN-2022
HHSURLAP/19000003627	Mr. Giridhar M Joshi & Mrs. Josphi Munniben Giridharilal & Mr. Josphi Kanaylalal Giridharilal	Rs. 17,77,584/- as on 24-Jan-2022	25-Jan-2022	07-Jan-2022
HHSURHOU/20000009584 & HHSURIRPL/20000009769	Mr. Manojbhai H Solanki & Mrs. Manishaben Manojbhai Solanki	Rs. 7,77,291/- as on 24-Jan-2022	25-Jan-2022	04-Jan-2022

Description of the Secured Assets / Immovable Properties / Mortgaged Properties:- All that piece and parcel of Residential Flat/Apartment bearing Flat No. 404, admeasuring about 102.5 sq. mt. super built up and 51.5 Sq. Mtr. built up, situated on the 4th floor of building No. H (As per site building no. A/16 and A/17 Paikae building No. A/17) of Saraswathi Green City organized on land bearing plot No. 119/A admeasuring about 13869 Sq. Mtrs. and its block No. 120 admeasuring about 21787 Sq. Mtrs. Total Admeasuring about 35647 Sq. Mtr. of Village-Umra Sub District Oldpal District-Surat, Gujarat-394125 with common amenities written in Title Document. Bounded By: North: Society Road; East: Plot No-127; West: Plot No-124; South: Plot No-109.
Description of the Secured Assets / Immovable Properties / Mortgaged Properties:- All that piece and parcel of Residential Plot/Land bearing Plot No. 125, Admeasuring about 55.20 sq.mt. (according to city survey bearing north no. 1049/A/122, admeasuring about 55.20 sq.mt.) of Mahavi Nagar originally organized on land bearing revenue survey No. 5/1 and 5/2 Paikae which is now having city survey North no. 1049 of Kosad/Amroli, within District Surat, Gujarat-394107. With common amenities written in Title Document. Bounded By: North: Society Road; East: Plot No-127; West: Plot No-124; South: Plot No-109.
Description of the Secured Assets / Immovable Properties / Mortgaged Properties:- All that piece and parcel of Residential Plot/Land bearing Plot No. 41, admeasuring about 43.00 Sq. Mtr. together with undivided share in Road and COP admeasuring about 26.62 Sq. Mtr. of Man Sarovar Villa organized on land bearing block No. 335, after reversion it was given new block No. 635, total admeasuring 41481 Sq. Mtr. Paikae Northern Eastern portion admeasuring about 10500 Sq. Mtr. of Utiyadara, Kosamba/Karmali Road, Sub District Ankleshwar, District Bharuch, Surat, Gujarat-394125 with common amenities written in Title Document. Bounded By: North: Plot No. -42; East: Plot No. -49; West: Society Road; South: Plot No. -40;
 *with further interest, additional interest at the rate as more particularly stated in respective Demand Notice dated mentioned above, incidental expenses, costs, charges etc incurred till the date of payment and/or realization. If the said Obligor(s) shall fail to make payment to HHFL as aforesaid, then HHFL shall proceed against the above Secured Asset(s)/Immovable Property(ies) under Section 13(4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Obligor(s) Legal Heir(s)/Legal Representative(s) as to the costs and conveniences survey No. 5/1 and 5/2 Paikae.
 The said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asset(s)/Immovable Property, whether by way of sale, lease or otherwise without the prior written consent of HHFL. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act.
 DATE : 08-02-2022, Sd/- AUTHORISED OFFICER
 PLACE : SURAT FOR HERO HOUSING FINANCE LIMITED

BOMBAY SUPER HYBRID SEEDS LIMITED
 CIN: L01132GJ2014PLC080273, Registered Office: Shreenathji Industrial Estate plot No.11, National Highway 8-B, Near Kuvadva GIDC, Kuvadva, Rajkot : 360023, Gujarat, Contact No. : +91 9638967796, Web: www.bombaysuperseeds.com, E-Mail : info@bombaysuper.in
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL STATEMENTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31st DECEMBER, 2021 (Amt in Lakhs)

PARTICULARS	QUARTER ENDED			9 MONTHS ENDED		YEAR ENDED
	31.12.2021	30.09.2021	31.12.2020	31.12.2021	31.12.2020	31.12.2021
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income From Operations	6,297.92	1,747.52	5,188.15	16,469.82	14,336.94	17,176.20
Profit / (loss) for the period before exceptional and extraordinary items and tax	275.56	76.00	202.84	946.61	438.47	610.70
Profit / (loss) for the period before tax after Exceptional Item*	275.56	76.00	202.84	946.61	438.47	610.70
Profit / (loss) for the period after tax after Exceptional Item*	267.56	59.73	158.94	912.01	367.75	579.91
Total Comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	267.56	59.73	158.94	912.01	367.75	559.40
Equity Share Capital	1049.37	1049.37	1049.37	1049.37	1049.37	1049.37
Reserves & Surplus	2,756.29	2,488.73	1,679.45	2,756.29	1,679.45	1,844.28
Earning per equity share in Rs.						
-Basic	2.55	0.57	1.69	8.69	3.91	5.33
-Diluted	2.55	0.57	1.69	8.69	3.91	5.33

Notes : The Financial Results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rule, as notified under section 133 of the Companies Act 2013 ("Act") and other accounting principles and policies extant applicable. The above Financial Results are also available on our website www.bombaysuperseeds.com & the stock exchange website www.nseindia.com.
 * There were no exceptional and extra-ordinary items for the reporting period.
Place : Rajkot, Date : February 07, 2022
 Sd/-
 Authorized Officer
 (Whole Time Director & CFO)

IDFC FIRST Bank Limited
 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)
 CIN : L65110TN2014PLC09792
 Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai - 600031.
 Tel: +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022
APPENDIX IV [Rule 8(1)]
POSSESSION NOTICE (For immovable property)
 Whereas the undersigned being the authorized officer of **IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with [rule 3] of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notices calling upon the Borrower/ Co-borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.
 The Borrower/ Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.

Loan Account Number	Co-borrowers/ & Guarantors Name	Description Of The Mortgaged Properties	Demand Notice		Date And Type Of Possession Taken
			Date	Outstanding Amount (Rs.)	
21197018	1. Dig Vijaybhai Gohel, 2. Renukaben Vijay Gohel	All The Piece And Parcel Of The Property Consisting Of Immovable Property Bearing Flat No. 102 On The 1st Floor Admeasuring 56.12 Sq. Mts. Carpet Area & 61.10 Sq. Mts. Built Up Area, Alongwith Undivided Share In The Land Of "Amrut Kunj", Building No. N-2 (As Per Plan Building No. B/3/B), Situated At Revenue Survey No. 134, Old Block No. 3039 (Old Block No. 333) Admeasuring He. Are. 3-10-37 Sq. Mts., T.P. Scheme No. 47 (Kholwad - Bhada), Original Plot No. 90/A & 90/B Admeasuring He. Are 3-10-37 Sq. Mts. I.E. 31037.00 Sq. Mts., Final Plot No. 90 Admeasuring 18622.00 Sq. Mts., Of Moje Village Kholwad, Ta: Kamrej, Dist: Surat. And Bounded By As Following : North : Passage/Lift, South : Open Space, East : Flat No. 101, West : Building No. N-1	20-04-2021	Rs. 19,75,266.76/-	04-02-2022 Symbolic Possession
21073399	1. Kanubhai C Sisara 2. Rekhaben Kanubhai Sisara	All The Piece And Parcel Of The Property Consisting Of Immovable Property, Bearing Booking Plot No. 38/As Per Passing Plan Plot No. F/38 & Re-Survey New Block/Plot No.2764) Admeasuring 104.45 Sq.Yards I.E. 87.33 Sq.Mtrs. (As Per Passing Plan Admeasuring 84.82 Sq.Mtrs. & Re-Survey Admeasuring 85.00 Sq.Mtrs.) In "Sahaj Row House", Situated At Revenue Survey No.21772 & 21771, Block No.238 Admeasuring 9038 Sq.Mtrs. Of Moje: Village Mankana, Ta: Kamrej, Dist: Surat And Bounded As: East : Soc. Road, West: Adj. Society, North : Plot No.39, South : Plot No.37	30-06-2021	Rs. 32,54,326.17/-	04-02-2022 Symbolic Possession
5087715 & 5566821	1. Khodiyar Impex 2. Nilesb Bavbhai Balidha 3. Shobhanaben N Balidha	All The Piece And Parcel Of The Property Consisting Of the property consisting Shop No G-1, Ground Floor, Anupam Square, Revenue Survey No. 148/2, Block No.157, T.P. Scheme No.24, Final Plot No.20/B, As Per Passing Sub-Plot No.1, Opp Pramukh Park Row House, Satellite Road, Mota Varachha, Surat-395010.	05-03-2019	Rs. 39,27,070.57/-	04-02-2022 Symbolic Possession
24017444	1. Rammikbhai Rajivbhai Ramani 2. Hansaben Rammikbhai Ramani,	All The Piece And Parcel Of The Property Consisting Of Immovable property Premises Of Plot No. 55 (As Per Passing Plan Plot No. F/55) Admeasuring 72.00 Sq. Yards I.E. 60.28 Sq. Mtrs. (As Per Passing Plan Admeasuring 60.28 Sq. Mtrs.), Alongwith Proportionate Undivided Share In Road & Cop, "Sahkar Bungalows", Developed Upon Land Situated In State: Gujarat District: Surat, Sub - District & Taluka: Kamrej, Moje: Village Kathon Bearing Revenue Survey No. 681, Block No. 548/B Admeasuring 24266.00 Sq. Meters, Paikae Sub Plot No. 2 N.A. Land Paikae. And Bounded By As Following : North : Adjoining Plot No. 54, South : Adjoining Plot No. A/55, East : Adjoining Plot No. 68, West : Adjoining Society Internal Road	20-04-2021	Rs. 23,53,551.98/-	04-02-2022 Symbolic Possession
14016883	1. Madhubhai N Joliya 2. Bhavanben Madhubhai Joliya	All The Piece And Parcel Of The Property Consisting Of Plot No.95 (As Per K.J.P. Block No.130/2/95) Admeasuring 43.19 Sq.Mts., Along With 31.37 Sq. Mts. Undivided Share In Land Of Road & C.O.P., Totally 74.56 Sq. Mts. In "Sajan Homes" Situate At Revenue Survey No.102, Old Block No.116, Re-Survey New Block No.130 Admeasuring 25072 Sq. Mts., Paiki Northern Side Sub Plot No.2 Admeasuring 12350 Sq.Mts., Of Moje Village Nansad, Ta: Kamrej, Dist : Surat, And Bounded As : North : Plot No.94, East : Society Boundary, South : Plot No.96, West : Society Internal Road	01-06-2021	Rs. 19,99,073.85/-	04-02-2022 Symbolic Possession
16227481	1. Mr. Niravbhai Himmatbhai Kareliya 2. Mrs. Hansaben Himmatbhai Kareliya	All The Piece And Parcel Of The Property Consisting Of Immovable Property, Bearing Flat No. 501, On The 5th Floor (As Per Passing Plan On The 4th Floor) Admeasuring 604.23 Sq.Ft. I.E. 56.15 Sq.Mts. Built Up Area, Alongwith 12.35 Sq.Mts Undivided Share In The Land Of Road & Cop, In "Shaliganj Building No. B" Situated At Revenue Survey No. 45, Block No. 48 Admeasuring 29729 Sq.Mts. Moje: Village Navagam, Ta: Kamrej, District: Surat And Bounded: East : Passage/Cop/Bldg. No. M. West : Society Road, North : Passage/ Road, South : Passage/Bldg. No. C	20-05-2021	Rs. 19,51,065.44/-	04-02-2022 Symbolic Possession
28852091, 29027708, 29029214, 34698547, 34701001 & 34702132	1. Ritaben Ashokbhai Korat 2. Ashokkumar Parsottambhai Korat 3. Vvn Impex	Property No 1:- All That Piece And Parcel Of Immovable Property, Premises Of Office No. 4, Admeasuring 51.68 Sq. Mtrs., Carpet Area, Admeasuring 54.49 Sq. Mtrs., Built Up Area, Alongwith Proportionate Undivided Land Share In Ground Land, "Fourth Floor", "Turning Point Plaza", Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub-District & Taluka Surat City (Now Adajan), Moje: Ultran, Revenue Survey No. 154/1, 155, Block No. 154, T.P. Scheme No. 27 (Ultran Kosad), Original Plot No. 55, Final Plot No. 60 N.A Land Paikae. And Bounded As : East : Final Plot No. 163, West : Road, North : Road, South : Road Property No 2:- All That Piece And Parcel Of Immovable Property, Premises Of Office No. 3, Admeasuring 54.91 Sq. Mtrs., Carpet Area, Admeasuring 57.85 Sq. Mtrs., Built Up Area, Alongwith Proportionate Undivided Land Share In Ground Land, "Fourth Floor", "Turning Point Plaza", Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub-District & Taluka Surat City (Now Adajan), Moje : Ultran, Revenue Survey No. 154/1, 155, Block No. 154, T.P. Scheme No. 27 (Ultran Kosad), Original Plot No. 55, Final Plot No. 60 N.A Land Paikae. And Bounded As : East : Final Plot No. 163, West : Road, North : Road, South : Road Property No. 3:- All That Piece And Parcel Of Immovable Property, Premises Of Office No. 4, Admeasuring 51.68 Sq. Mtrs., Carpet Area, Admeasuring 54.49 Sq. Mtrs., Built Up Area, Alongwith Proportionate Undivided Land Share In Ground Land, "Second Floor", "Turning Point Plaza", Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub-District & Taluka Surat City (Now Adajan), Moje : Ultran, Revenue Survey No. 154/1, 155, Block No. 154, T.P. Scheme No. 27 (Ultran Kosad), Original Plot No. 55, Final Plot No. 60 N.A Land Paikae. And Bounded As : East : Final Plot No. 163, West : Road, North : Road, South : Road	23-10-2021	Rs. 67,72,253.78	04-02-2022 Symbolic Possession
6435548	1. Mr. Manoj Marutibhai Sangle 2. Mrs. Surekha Manojbhai Sangle,	All The Piece And Parcel Of The Property Consisting Of Flat No 102 On The 1st Floor Admeasuring 17.74 Sq. Fts. Carpet Area & 21.29 Sq.Mts. Built Up Area Along With Undivided Share In The Land Of "Vasundhara Apartment Of Virammagar Society "Situated At Revenue Survey No.23, Town Planning Scheme No. 18 (Katargam), Final Plot No. 75 & 75, Viram Nagar Society Paiki, Plot No. Ab/7, City Survey Ward Tunki, North No. 1915 & 1916 Total Admeasuring 104. 12 Sq. Mts. Of Moje Village Tunki (Katargam), Nr. Akhand Anand School, City Of Surat And Bounded As Following : North : Flat No.101 South: Flat No. 103, East: Building, West : Enters Gate	11-04-2021	Rs. 6,17,302.17/-	04-02-2022 Symbolic Possession
26691005 & 26691743	1. Krush j khokhariya, 2. Janak jerambhai khokhariya 3. Kanchanben jerambhai khokhariya	All The Piece And Parcel Of The Property Consisting Of Immovable Property Bearing Flat No.A/402 On Fourth Floor, Building No. A & B Paikae, Building No.A, Prayagraj Apartment, Area Admeasuring 63.5 Sq. Mtrs. Along With Proportionate Undivided Share In Ground Land Ad			

